



## કાઈમ બ્રાંચ, સુરત શહેર

સરનામુ- ચોકબજાર કુરજા, ધનરાજ પેટ્રોલ

પંપની બાજુમાં, સુરત શહેર

સંપર્ક નંબર-૦૨૬૧-૨૪૩૬૦૨૪



બેંક ખાતેદારના મોબાઈલ ફોન હેક કરી પ્રા.લી.કંપનીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી,  
ઓનલાઈન ચીટીંગ કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર કાઈમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર કાઈમ બ્રાંચના અધિકારી/પોલીસ માણસોની ટીમ કામગીરીમાં હતી. દરમિયાન પો.સ.ઈ.પી.કે.પટેલ નાઓની ટીમના હે.કો.શૈલેષ રાઘેબિહારી અને પો.કો.મનોજ તુકારામ નાઓને મળેલ હકીકત આધારે ઉધના ત્રણ રસ્તા સોમનાથ હોટલ સામે જાહેર રોડ પરથી આરોપી:- (૧) રામસીંગ ઉર્ફે પ્રચિત કોમલસીંગ પુરણલાલ મહેરા ઉ.વ.૨૮ રહે.મકાન નં-૨૦૧૭, રાજીવનગર એમ.પી.નગર, મહેદામીલ ભોપાલ શહેર તથા આરોપી નં. (૨) જાવેદ મો.શરીફ ખટીક ઉ.વ.૩૪ રહે.મચ્છીબજાર સાતપીરગલી તા.નંદુરબાર જી.નંદુરબાર.(મહારાષ્ટ્ર) નાઓને પકડી પાડી તેમના કબજામાંથી અલગ અલગ કંપનીની એ.ટી.એમ. કાર્ડ નંગ-૧૩ તેમજ જુદી જુદી બેંકની એકાઉન્ટ કીટ બુક નંગ. ૦૭ તેમજ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૩૦,૦૦૦/- અને અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૮૪,૭૦૦/- નો મુદ્દામાલ મળી કુલ રૂ.૧,૧૪,૭૦૦/- ના મત્તાનો કબજે કરી, આરોપીઓ વિરુદ્ધમાં મુંબઈ થાણે બી.કે.સી. પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં-૩૧૯/૨૦૧૮ ઈ.પી.કો. ક. ૪૧૯, ૪૨૦ તથા IT ACT-૬૬(C) ,૬૬(D) વિગેરે ગુનો નોંધાયેલ હોય સદર ગુનાના કામે હકીકત એવી રીતેની છે કે, ઈકો બ્રીલીએન્સ પ્રા.લી. નામની કંપનીના એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ઈસમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રૂ.૨૭,૦૦,૦૦૦/- ઉપાડી લીધેલ હતા. જે અનુસંધાને મુંબઈ થાણે બી.કે.સી.પો.સ્ટે.ના પોલીસ માણસો સુરત શહેર કાઈમ બ્રાંચ સાથે સંપર્ક કરી આ ગુનાના આરોપીઓ સુરત શહેર ખાતે આવનાર હોય જે આધારે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી મુંબઈ બી.કે.સી.પો.સ્ટે.ના પોલીસ માણસોને સોંપવામાં આવેલ છે. સદર ગુનાના કામે ઉપરોક્ત પ્રાઈવેટ લીમીટેડ કંપનીનું એકાઉન્ટ સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાડુ નેટ બેંકીંગ સાથે કનેક્ટ કરેલ મોબાઈલ નંબરને આરોપીઓએ હેક કરી ત્યારબાદ ઓનલાઈન O.T.P. મેળવી લઈ કંપનીમાંથી રોકડા રૂ.૨૭,૦૦,૦૦૦/- અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઈ રોકડા રૂપિયા ઉપાડી લઈ એકબીજાની મદદગારીથી ગુનો આચરેલ જે ગુન્હે વણશોધાયેલા જે શોધી કાઢી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.